

સંયુક્ત ભાડુઆત માટે લૉકર ભાડે રાખવાનો કરાર

શાખાનું નામ		શાખાનો કોડ		લૉકર સીરિઝ અને નંબર		ચાવી નં.			
લૉકર સાઈઝ		શાખા શહેર શ્રેણી		સંચાલનનો પ્રકાર :				1લા ભાડુઆતનો ફોટો	2જા ભાડુઆતનો ફોટો
ભાડુ વસૂલ કરવા માટે ખાતું		ગ્રાહક આઈડી		માફી % :	પ્રબંધિત ગ્રાહક	☐ પહેલું લૉકર ☐ બીજું લૉકર		3જા ભાડુઆતનો ફોટો	
રેક દર		ભાડાનો દર		માફીનું કારણ :					

એચડીએફસી બેંક લિમિટેડ, _____ (શાખાનું નામ) (હવે પછી અહીં “બેંક” તરીકે ઉલ્લેખ કરાશે)

(ભાડુઆત/તોના નામ અને સરનામા)

પછી અહીં ભાડુઆત/તો તરીકે ઉલ્લેખ કરાશે) બેંકનું લૉકર નં. _____ (“લૉકર”) વર્ષ _____ માટે આજરોજથી અહીં જણાવેલ નિયમો અને શરતો અનુસાર નિર્ધારિત કરેલ હોય એ સિવાય પ્રતિ વર્ષ રૂ. _____ ના (અગાઉથી ચૂકવવાપાત્ર) ભાડાં પર તેમ જ તેને લગતા બેંક ના અહીં પાછળ જણાવેલા વખતો વખત લાગુ નિયમો અને શરતોને આધીન આપવા સહમત થાય છે અને ભાડુઆત/તો તે ભાડે લેવા સહમત થાય છે. ભાડુઆત/તો લૉકરના ભાડાંની વસૂલી પેટે અહીં ઉપર જણાવેલ બેંક અકાઉન્ટ દર વર્ષે એડવાન્સમાં ડેબિટ કરવા બેંકને અધિકૃતતા આપે છે. ભાડુઆત/તો ત્યારબાદ બેંકની મુનસફીએ તેમ જ બેંક દ્વારા વખતો વખત નિર્ધારિત કરવામાં આવે એ દર અને મુદત તથા નિયમો અને શરતો અનુસાર આગળ ચાલુ રાખી શકે છે.

નામાંકન : ☐ હા (જો હા, તો કૃપા કરી નીચે નામાંકનની વિગતો ભરો) / જો લાગુ ન હોય તો છેકી નાખો

સંયુક્ત ભાડુઆત(તો) માટે નામાંકન આલેખ (ફોર્મ એસએલ1એ) (ફકરો 1.પ.2 (શ)(ક) અનુસાર)

બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 45ZE અને બેંકિંગ કંપનીઝ (નોમિનેશન) રુલ્સ, 1985 ના રુલ 4(2) અંતર્ગત લૉકર સંદર્ભે સંયુક્ત ભાડુઆતોએ કરવાનું રહેતું નામાંકન.

અમે, _____ (નામ અને સરનામું)

નીચે જણાવેલ વ્યક્તિનું નામાંકન કરીએ છીએ જેને અમારા માંથી એક અથવા વધુનું મૃત્યુ થવાના કિસ્સામાં

(લૉકર જ્યાં આવેલું હોય એ શાખા/કાર્યાલયનું નામ અને સરનામું)
લૉકરની પહોંચ તેમ જ લૉકરમાં રહેલ વસ્તુઓ કાઢવાની સ્વતંત્રતા અમારા માંથી જીવીત રહેલ વ્યક્તિ સાથે સંયુક્તપણે આપવામાં આવી શકે છે, જેની વિગતો નીચે આપવામાં આવી છે.

નામાંકન કરેલ વ્યક્તિઓની વિગતો			
નામ, સરનામું અને સંપર્ક નં.	ભાડુઆત સાથે સંબંધ	ઉંમર	નામાંકન કરેલ વ્યક્તિની જન્મ તારીખ (સગીર હોય તો)

પાલકની વિગતો (જો નામાંકન કરેલ વ્યક્તિ સગીર હોય તો)

સાક્ષીઓનું/ના નામ(મો), સરનામું(મા) અને સહી(ઓ)@: _____ (નામ અને સરનામું)

@માત્ર અંગૂઠાની છાપ/માતૃભાષામાં ઘોષણા કરવાના કિસ્સામાં.

નામાંકન: ☐ ના, હું ઘોષિત કરું છું કે હું નામાંકન કરવા નથી ઇચ્છતો.

હું ભાડુઆત/અમે ભાડુઆત/તો પાછળના પાના પર જણાવેલા નિયમો અને શરતો તથા રુલ્સ વાંચ્યા અને સમજી લીધાનું સ્વીકારીએ અને પુષ્ટી કરીએ છીએ તથા તેનું પાલન કરવા અને બંધનકર્તા રહેવા સહમત થઈએ છીએ. લૉકર નં. _____ માટે ચાવી નં. _____ આ સાથે સીલબંધ રીતે બેંક દ્વારા ભાડુઆત/તો ને સોંપવામાં આવી છે, જે મળ્યાની પહોંચ ભાડુઆત/તો દ્વારા આપવામાં આવી છે. આ કરારની વિગતો તથા નિયમો અને શરતો સહિત રુલ્સ જે પાછળના પાને જણાવેલા છે તે ભાડુઆત/તો દ્વારા વાંચવામાં અને સમજી લેવામાં આવ્યાં છે અને પાછળના પાને આપેલા દરેક લખાણ સાથે તેઓ સહમત છે તથા તેનું પાલન કરવા બંધનકર્તા રહેવા માટે સહમત થાય છે. આ કરાર તેમ જ પાછળના પાને વિસ્તૃત જણાવેલા નિયમો અને શરતોની પ્રત ભાડુઆત/તોને પ્રાપ્ત થઈ છે.

અરજકર્તા	નામ	ગ્રાહક આઈડી	સહી
પ્રથમ ધારક			
બીજા ધારક			
ત્રીજા ધારક			

નોંધ : કૃપા કરી પત્રકમાં સહી કરતા પહેલા બધા જ સુસંગત વિભાગોમાં તમને સંતોષકારક રીતે વિગતો જણાવી હોય તે સુનિશ્ચિત કરશો.

એચડીએફસી બેંક લિ. વતી (અધિકૃત સહીકર્તા) _____

તારીખ : _____ સ્થળ : _____

નિયમો અને શરતો

1. સેફ ડિપોઝિટ વોલ્ટ રવિવાર અને બેંકમાં રજાના દિવસો સિવાય દરરોજ કામકાજના સમય દરમિયાન ખુલ્લું રહેશે. આ દિવસોએ અને નિર્દિષ્ટ સમયે ભાડુઆત/તો તેનો ઉપયોગ કરી શકે છે.
2. લૉકરના ઉપયોગ માટેનાં ઉપર જણાવેલા સમયમાં ફેરફાર કરવાની બેંકને છૂટ રહેશે તથા બેંકને યોગ્ય લાગે તે શરતો ઉમેરી શકે છે અને આ માટેની સૂચના ભાડુઆત/તો ને આપશે અને ભાડુઆત/તો તેને બંધનકર્તા રહેશે.
3. બેંક દ્વારા વખતો વખત નિર્ધારિત કરવામાં આવી શકતા લૉકરની પહોંચના માધ્યમો અને ભાડુઆત(તો) અથવા તેના એજંટ (જો નિયુક્ત કરેલ હોય તો)ની ઓળખ સંબંધિત દરેક નિયમો અને નિયમોનું પાલન કરવાનું રહેશે.
4. જો કોઈ લૉકર બાબતે સંયુક્ત ભાડુઆતો વચ્ચે કોઈ વિવાદ થાય તો ભાડુઆત/તો લૉકર ખોલવા પર પ્રતિબંધ મૂકવાની અરજી કરી શકે છે, જો કે સંચાલનના દિશા-નિર્દેશોમાં કોઈપણ ફેરફાર માટે દરેક ભાડુઆત/તોની સહી કરેલી અરજી બેંકમાં રજુ કરવાની રહેશે.
5. જો ભાડુઆત/તો લૉકરના સંચાલન માટે કોઈ અધિકૃત એજંટ નિયુક્ત કરવા ઇચ્છતા હોય તો ભાડુઆત/તો એ એવા એજંટના પક્ષમાં પાવર ઓફ એટર્ની કરવાની રહેશે અને/અથવા બેંક દ્વારા આવશ્યક કરવામાં આવે તે અન્ય દસ્તાવેજો તૈયાર કરાવવાના રહેશે તેમ જ આ એજંટ વખતો વખત બેંક દ્વારા નિર્ધારિત કરાતા નિયમો અને નિયમોનું પાલન કરવા બંધનકર્તા રહેશે. જોકે, આવા એજંટને લૉકર સુધી પહોંચ મંજૂરી આપવાથી થતા નુકસાન માટે બેંકને કોઈપણ સમયે જવાબદાર નહીં ઠેરવવામાં આવે કે ન તો બેંક કોઈ ખર્ચા માટે ઉત્તરદાયી બનો અને ભાડુઆત/તો એ બેંકને નુકસાન ભરપાઈ કરવાનું રહેશે તથા લૉકરના સંચાલન સંદર્ભે આવા એજંટના કાર્યો માટે બેંકની સામે કરેલા દરેક દાવા અને માંગો પર બેંકને નુકસાન ભરપાઈ કરવાનું રહેશે અને તેને નુકસાનથી સુરક્ષિત રાખવાની રહેશે. બેંક તેના નિર્દેશ દ્વારા આવા એજંટને લૉકર સુધી પહોંચ આપવાની મનાઈ કરી શકે છે.
6. સંયુક્ત ભાડુઆત/તોનું મૃત્યુ થવાના કિસ્સામાં તેમના ઉત્તરજીવી/કાનૂની વારસદારો/નામાંકન કરેલ વ્યક્તિ લૉકરનું સંચાલન કરવાના હકદાર રહેશે. ઉત્તરજીવી પોતાના નામે લૉકરને ભાડાં પર આગળ લઈ જઈ શકે છે, એવાં નિયમો અને શરતો પર બેંક સામગ્રી દૂર કરી અથવા બેંકને ચાવી સોંપીને આ બાબતે નિર્દેશ કરી શકે છે અથવા લૉકરનું સમર્પણ કરી શકે છે. ઉત્તરજીવી, નામાંકન કરેલ વ્યક્તિ, કાનૂની વારસ ઉપરાંત અન્ય કોઈના દ્વારા કોઈ દાવો કરવાના કિસ્સામાં બેંકને જવાબદાર નહીં ઠેરવી શકાય. કોઈ ભાડુઆત દ્વારા લૉકરનો સામાન મેળવવા, કોઈ વ્યક્તિને બેંકના નામાંકનના નિયમો અનુસાર નામાંકન કરવા પર સામાનને નામાંકન દિશા-નિર્દેશો અનુસાર વિતરિત કરવામાં આવશે.
7. ભાડુઆત/તો આવશ્યકતા જણાવવા પર લૉકરની સ્થિતિ તેમ જ દશાની તપાસ કરવા અને કોઈપણ સમારકામ/સમાયોજન કરવા તેમ જ લૉકરનો ઉપયોગ સંબંધિત નિયમો અને શરતો અનુસાર કરાય છે તે સુનિશ્ચિત કરવા માટે બેંકને લૉકરની પહોંચ પૂરી પાડશે. પરંતુ બેંક તેમાં રહેલા સામાનની માહિતી હોવા અથવા તેની માટે જવાબદાર નહીં માનવામાં આવે.
8. સહમતી આપેલ દરેક ભાડાં યુસ્તપણે અગાઉથી અથવા અગાઉની મુદતના છેલ્લા દિવસે આવતી મુદત માટે ચૂકવવાપાત્ર રહે છે અને બેંક લૉકરની પહોંચ પૂરી પાડવાથી ઇનકાર કરવાનો અધિકાર પોતાની પાસે અબાધિત રાખે છે. જો કોઈ ભાડુ, માગણી કરાયેલ અથવા ન કરાયેલ કે પછી વધારેલું ભાડું ચૂકવવામાં ન આવે તો બેંક આ ભાડાંની રકમ ભાડુઆત/તોના બેંક સાથેના ખાતામાં ભાડુઆતોને વધુ કોઈ સંદર્ભ વિના ઉધારી શકે છે (પરંતુ આ કરવા માધ્યમ નહીં રહે) અને જેઓ આ દ્વારા જ્યાં પણ ભાડું પાડી ગયું અને બેંકને ચૂકવવાપાત્ર હોય ત્યાં તેનું/તેણીનું/તેમનું ખાતું ઉધારવા (ડેબિટ કરવા) બેંકને અધિકૃતતા આપે છે. બાકી રહેલું ભાડું બેંકને પૂરેપૂરું ચૂકવવામાં ન આવે ત્યાં સુધી 18% દરે વ્યાજ સહિત એકસાથે ચૂકવવાપાત્ર રહેશે.
9. લૉકરના ભાડાં પર વખતો વખત લાગુ થાય તેમ કરવેલા લાગુ રહેશે.
10. બેંક તેની સંપૂર્ણ મુનસફીએ ભાડાંમાં સુધારો/વધારો કરવા હંમેશા હકદાર રહેશે અને ભાડુઆત/તો બેંક દ્વારા તે નક્કી કરવામાં આવે એ તારીખથી ચૂકવવા માટે જવાબદાર રહેશે.
11. ગ્રાહક દ્વારા ભાડે રખાયેલ લૉકરની ગ્રાહકની ચાવી બધાં જ સંયુક્ત ભાડુઆતોને સંયુક્તપણે આપવામાં આવશે. આ ચાવી હરહંમેશા બેંકની મિલકત રહેશે. માસ્ટર ચાવી હંમેશા બેંક પાસે જ રહેશે. ભાડુઆત/તો એ સમજે છે કે લૉકર બંને ચાવીઓના ઉપયોગથી જ ખોલી શકાય છે નહીં કે કોઈ એક ચાવીના ઉપયોગથી. અને લૉકર બંધ કરવા માસ્ટર કીની જરૂર નથી પડતી. ભાડુઆત/તોને માત્ર ગ્રાહકની ચાવી દ્વારા જ લૉકર ખોલવાની પરવાનગી છે અને બેંક દ્વારા પૂરી પડાયેલ ગ્રાહક ચાવી સિવાયની અન્ય કોઈ ચાવી દ્વારા લૉકરનું સંચાલન કરવાની પરવાનગી નહીં રહે.
12. જો ભાડુઆત/તો દ્વારા ગ્રાહક ચાવી ખોવાઈ જાય તો તેમણે ચાવી ખોવાઈ ગયાની સૂચના બેંકની વિના વિલંબે લેખિતમાં આપવાની રહેશે તથા ઇન્ડેમ્નિટી સહિત એફઆઈઆર/પોલીસ ફરિયાદની પહોંચ બેંકને આપીને ભાડુઆતની લેખિત અરજી કરવા પર નવી ચાવી તેને આપવામાં આવી શકે છે. બ્લેક ઓપન પ્રક્રિયા માટે બધાં જ ભાડુઆત/તો લૉકર બ્રાન્ચમાં હાજર હોવા જરૂરી છે. લૉકર ખોલવા/તોડવા માટે, ખોવાઈ ગયેલી ચાવી સામે નવી ચાવી લેવા તથા લૉક બદલવા માટે લાગતો બધો જ ચાર્જ ભાડુઆતે ચૂકવવાપાત્ર રહેશે. લૉકર, લૉક અથવા ચાવીને જરૂરી બધું જ સમારકામ વિશેષતઃ બેંક દ્વારા નિયુક્ત કાર્યકર દ્વારા કરવામાં આવશે.
13. ભાડુઆત/તોને તેના/તેણીના/તેમનાં લૉકરની ગ્રાહક ચાવી સુરક્ષિત જગ્યાએ રાખવા ચેતવવામાં આવે છે અને અન્ય કોઈ વ્યક્તિને તેના/તેણીના/તેમનાં લૉકરનો નંબર અને/અથવા તેનો પાસવર્ડ (જો આપ્યો હોય તો) અન્ય કોઈ વ્યક્તિને ન જણાવવા તેમ જ ગ્રાહક ચાવી તેના/તેણીના/તેમનાં અધિકૃત એજંટ (જો નિયુક્ત કરેલ હોય તો) સિવાય અન્ય કોઈ વ્યક્તિને ન જણાવવા કહેવામાં આવે છે. ભાડુઆત/તો ગ્રાહક ચાવી મળી ગયાની પહોંચ પૂરી પાડશે અને આ કારાર થવા પર તે બેંકને સોંપી દેશે.
14. બધાં જ ભાડુઆતોએ લૉકર સરન્દર કરવા લૉકર શાખામાં પ્રત્યક્ષ હાજર રહેવું ફરજિયાત છે.
15. ભાડુઆત/તો લૉકરમાં કોઈ મિલકત અધિકાર નહીં ધરાવે પરંતુ આ કારાર ચાલુ રહે ત્યાં સુધી તેમ જ તેમાં જણાવેલા નિયમો અને શરતો અનુસાર માત્ર તેના ઉપલોકતાને સવિશેષ અધિકાર અને તેની પહોંચ ધરાવે છે. ભાડુઆત/તો લૉકર અથવા તેનો કોઈ ભાગ ફાળવશે, હસ્તાંતર કરશે અથવા પેટાં ભાડે નહીં આપે કે ન તો તેનો ઉપયોગ દસ્તાવેજો, ઘરેણાં અથવા અન્ય મૂલ્યવાન વસ્તુઓ જમા કરવા સિવાયના અન્ય હેતુ માટે કરવાની પરવાનગી નહીં આપે તેમ જ આનો ઉપયોગ કોઈ વિસ્ફોટક અથવા વિનાશક અથવા અનુદિત સ્વરૂપની અથવા પ્રકારની કે જે બેંકના મતાનુસાર અડચણપ્રદ બને/બની શકે તેવી વસ્તુ ગણવા મિલકત જમા કરવા માટે નહીં કરે. ભાડુઆત/તો દ્વારા આ જોગવાઈથી વિપરિત

- લૉકરનો ઉપયોગ કરવા પર થતા કોઈ ખર્ચા, માગણી, દાવા, નુકસાન, હાનિ, લાગત સામ બેંકને ઇન્ડેમ્નિટીકાર્ય કરશે. ભાડુઆત/તો બેંક દ્વારા જયારે પણ આવશ્યક જણાય ત્યારે તેને ઉપરોક્ત શરતનું પાલન કરવામાં આવે છે તે ખાતરી કરવા લૉકરનો સામાન ચકાસવાની પરવાનગી આપે છે.
16. અન્ય ઉપાયો માટે પૂર્વાગ્રહ રાખ્યા વિના કે જે બેંક ભાડુઆત/તો સામે ધરાવી શકે, લૉકરના ઉપયોગ માટેનાં ભાડુઆત/તોના બધાં જ અધિકારો બેંકના પોતાના વિકલ્પે જો અગર ભાડું માગણી કરેલ અથવા ન કરેલ અને અન્ય કોઈ ચાર્જિસ પાડેલા અને ચૂકવવાપાત્ર ચૂકવવામાં ન આવે, અથવા અહીં જણાવેલી કોઈપણ શરતનું ભાડુઆત/તો દ્વારા ઉલ્લંઘન કરવા પર રદ કરવામાં આવી શકે છે અને બેંક તેની મરજી મુજબ ભાડુઆત/તોના છેલ્લા નોંધ કરાયેલા સરનામા પર રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા ત્રીસ દિવસ અગાઉ લેખિત સૂચના મોકલીને લૉકર તોડીને ખોલી શકે છે અને તેમાં રહેલ બધો જ અથવા કોઈપણ સામાન જાહેર હરાજી દ્વારા અથવા ખાનગી સંધિ દ્વારા વેચીને બાકી રહેલ ભાડું અને/અથવા અન્ય ચાર્જિસ, ઉપરોક્ત સંબંધિત ખર્ચા, વેચાણ પાછળ થયેલ ખર્ચની તેની લેવાની નીકળતી રકમ વસૂલી શકે છે અને ત્યારપછી જો કોઈ પુરાંત ઉપલબ્ધ હોય અથવા સામાન બાકી રહે તો બેંક તે ભાડુઆત/તોને આ સામાન તેમાં નોંધાવી કુત સરનામા પર પાર્સલ દ્વારા અથવા અન્ય કોઈ જવાબદાર માધ્યમો મારફત કે પછી વધેલી રકમ પેર્ઓર્ડિર અથવા ડીમાન્ડ મારફત ભાડુઆત/તોને તેના/તેણીના/તેમના જોખમે અને જવાબદારીએ મોકલાવી શકે છે અથવા તે અન્ય કોઈ લૉકરમાં કે જગ્યાએ ચૂકવવાપાત્ર ભાડાં સાથે અથવા ખાતામાં કોઈ ચૂકવવાપાત્ર વ્યાજ વગર બેંકને યોગ્ય લાગે તેમ પોતાની પાસે જ રાખી શકે છે. જો લૉકર એકથી વધુ વર્ષ સુધી ખોલવામાં ન આવે તો બેંક તેની સંપૂર્ણ મુનસફીએ લૉકરની ફાળવણી રદ કરી શકે છે અને લૉકર ખોલી શકે છે, ભલે પછી તેનું ભાડું નિયમિત ચૂકવવામાં આવ્યું હોય.
17. બંને માંથી કોઈ પણ પક્ષકાર ભાડાંની સહમતિ સાધેલ મુદત રદ થવાની તારીખથી ત્રીસ દિવસ અગાઉ આ કારાર રદ કરવાના ઇરાદાની લેખિત સૂચના અન્ય પક્ષકારને આપીને આ કારાર રદ કરી શકે છે અને ભાડુઆત/તો લૉકરની ગ્રાહકની ચાવી સૂચનાની સમાપ્તિની તારીખના દિવસે અથવા પહેલા બેંકને સોંપી દેશે. કારાર રદ કરવાના કિસ્સામાં ભાડુઆતે/તોએ પહેલા જ ચૂકવી દીધેલા એડવાન્સ ભાડાંનું રીફંડ બેંક દ્વારા નહીં આપવામાં આવે.
18. જો ઉપર જણાવ્યા મુજબની કોઈ સૂચના આપવામાં ન આવી હોય અને ભાડુઆત/તો દ્વારા ગ્રાહક ચાવી પાછી ન સોંપવામાં આવી હોય તો બેંકના વિકલ્પે ભાડાંની મંજૂરી મુદતની સમાપ્તિ તારીખ પછી લૉકર ફરી ભાડે આપવામાં આવી શકે છે પરંતુ આ શરત આ દરમિયાન બેંકના જમા થયેલા અધિકારો સામે પૂર્વાગ્રહ વિના લાગુ રહે છે.
19. કોઈ અગત્યના કારણ અથવા તાત્કાલિક આવશ્યકતા ઊભી થવા પર બેંક તેને જરૂરી સમજે એ મુદત સુધી વૉલ્ટ બંધ કરવાનો અધિકાર અબાધિત રાખે છે અને ભાડુઆત/તોને કોઈ સૂચના આપ્યા વગર લૉકરનો ઉપયોગ કરવાની મનાઈ કરી શકે છે અથવા ભાડુઆત/તોને લૉકર માંથી તાત્કાલિક સામાન કાઢી લેવા કહી શકે છે અને જો આ જોગવાઈનું પાલન ન કરવામાં આવે તો તેને લીધે થતા નુકસાન માટે ભાડુઆત/તો જવાબદાર રહેશે.
20. લૉકરના ઉપયોગ દરમિયાન વૉલ્ટના દરવાજા અથવા લૉક બ્રાજ અથવા જવાબે લીધે થતા કોઈ વિલંબના પરિણામ સ્વરૂપ થયેલા કોઈ નુકસાન અથવા હાનિ માટે બેંક જવાબદાર નહીં રહે.
21. બેંક ન્યાયાલયના આદેશનો અમલ કરતા અથવા ન્યાયી પ્રક્રિયા દ્વારા તેને અપાયેલા અધિકારો અંતર્ગત તેની સંપૂર્ણ મુનસફીએ લૉકર તોડી શકે/ઇન્વેન્ડરી લઈ શકે અને/અથવા લૉકર તેમ જ તેમાં રહેલા સામાનનો કબજો કોઈ અન્ય વ્યક્તિ/ઓને સોંપી શકે છે અને આ કિસ્સામાં લૉકરમાં રહેલા સામાનના કોઈ નુકસાન અથવા હાનિ થવા પર બેંક જવાબદાર નહીં રહે.
22. ભાડુઆત/તોના સરનામામાં થતા કોઈ ફેરફારની સૂચના બેંકને ભાડુઆત/તો એ વિના વિલંબે લેખિતમાં આપવાની રહેશે તથા બેંક દ્વારા કોઈ પત્રવ્યવહારની સૂચના ભાડુઆત/તોને બેંકની બુક્સમાં નોંધાયેલા તેમના રજિસ્ટર્ડ સરનામા પર ટપાલ દ્વારા મોકલેલ હોય તેને યોગ્ય રીતે બજાવણી કરેલ માનવામાં આવશે.
23. આ કારારની ચાલુ મુદત દરમિયાન લૉકરમાં રહેલા સામાનના થતા કોઈ નુકસાન અથવા હાનિ માટે જવાબદાર નહીં રહે જે વરસાદ, આગ, પૂર, ભૂકંપ, વીજળી પડવી, સામાજિક બળવો, યુદ્ધ, રમખાણ કે પછી અન્ય કોઈ કારણ/ઓ કે જે બેંકના નિયંત્રણમાં ન હોય તેને લીધે થયેલ હોય તથા ભાડુઆત/તો દ્વારા કોઈ સામાન લૉકરની બહાર રાખી મૂકવાથી તેમને થતા કોઈ નુકસાન માટે પણ બેંક જવાબદાર નહીં રહે.
24. એ સ્પષ્ટ સમજવામાં આવ્યું છે કે બેંક અને ભાડુઆત/તો વચ્ચેનો સંબંધ ભાડુઆત અને માલિકનો છે નહીં કે બેંક અને ગ્રાહકનો.
25. લૉકરમાં રહેલી બધી જ સંપત્તિ ભાડુઆત/તો તરફથી બેંકને ચૂકવવાના રહેતા દરેક નાણાં સામે જનરલ લીયેનને આધીન પ્રાપ્ત કરવામાં અને જાળવવામાં આવે છે અને બેંક તેને લેવાના નીકળતા પરંતુ ન ચૂકવેલા નાણાંની પૂર્તિ કરવા આ સંપત્તિ અથવા તેનો હિસ્સો વેચવાનો અધિકાર ધરાવે છે.
26. બેંક દ્વારા તેની સંપૂર્ણ મુનસફીએ યોગ્ય મનાય એ રીતે સામાન્ય સાવચેતીના એ બધાં જ પગલાં લેવામાં આવશે ત્યારે લૉકરમાં જમા કરેલ સામાનને થતા કોઈ નુકસાન અથવા હાનિ માટે બેંક કોઈ જ જવાબદારી અથવા ઉત્તરદાયિત્વ સ્વીકારતી નથી. એ જ રીતે, ભાડુઆત/તોને તેમના હિતમાં બેંક સાથેના લૉકરમાં જમા કરેલ મૂલ્યવાન સામાનનો વીમો કરાવવાની સલાહ આપવામાં આવે છે.
27. બેંક દ્વારા વખતો વખત આલેખિત કરાતા તેમ જ લૉકર ભાડે આપવા અપનાવવામાં આવતા નિયમો અને નિયમોનું પાલન કરવા ભાડુઆત/તો સહમત થાય છે.
28. ભાડુઆત/તો બેંકને ક્ષતિપૂર્તિ પૂરી પાડશે તથા ભાડુઆત/તો દ્વારા કોઈ નિયમ અને શરતનું ઉલ્લંઘન કરવાને લીધે થઈ શકતા કોઈ નુકસાન, હાનિ, લાગત, ખર્ચ, કુત્યો, કાર્યવાહી સામે બેંકને હરહંમેશા ક્ષતિપૂર્તિ પૂરી પાડી સુરક્ષિત રાખશે.
29. આ કારાર અંતર્ગત ઊભી થતી દરેક બાબતો, મુદ્દાઓ તેમ જ લૉકર ભાડે રાખવાના હેતુસર આ કારાર હેઠળના પક્ષકારો ભારત, મહારાષ્ટ્રમાં મુંબઈ ન્યાયાલયના ન્યાયાધિકારને આધીન રહે છે.
30. બેંક લૉકર ફાળવવા સમયે તેની સંપૂર્ણ મુનસફીએ લૉકરના ભાડાં પેટે સંયુક્ત ભાડુઆત/તો પાસેથી સલામતી તરીકે ફિક્સડ ડિપોઝિટ મેળવી શકે છે. સંયુક્ત ભાડુઆત/તો દ્વારા લૉકરનું ભાડું ન ચૂકવવા પર બેંક આ ફિક્સડ ડિપોઝિટ પર લીયેન રાખવાનો અને સેટ ઓફ કરવાનો અધિકાર રહેશે.
31. અમે સ્વીકૃત કરીએ છીએ કે અમે આ કારારની એક પ્રત મેળવી છે.

માત્ર કાર્યાલયના ઉપયોગ માટે

પ્રાપ્ત કરેલ પ્રોટેક્ટા ભાડું (રૂ)	પ્રાપ્ત તારીખ :	અધિકૃત અને પ્રમણિતકર્તા	એસડીબી નંબર	સહી(ઓ) ચકાસનાર (અધાશરો) :	લૉકર કરરોડિયનનું નામ, સહી અને એમ્પ. કોડ	બ્રાન્ચ મેનેજર/બેંક અપનું નામ, સહી અને એમ્પ. કોડ
	સીપીયુ પર મોકલ્યું :					